MURAE ORGANISOR LIMITED

(Formerly known as Earum Pharmaceuticals Limited)

CIN: L24230GJ2012PLC071299

Regd. Office: A-1311, Sun West Bank, Ashram Road, Ashram Road P.O, Ahmedabad,

Ahmedabad City, Gujarat - 380009

E-mail: earumpharma@gmail.com Website: www.earumpharma.com

Date: 4th April, 2024

To,

BSE Limited

Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001.

Dear Sir/ Madam,

Sub: Newspaper Advertisement for Notice of Extra Ordinary General Meeting Ref: Security ID: MURAE / Code: 542724

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we hereby enclose the copies of the public notice of the Extra Ordinary General Meeting of the Company to be held on Wednesday, 24th April, 2024 at 2:00 P.M., published on 4th April, 2024 in:

- 1. English Newspaper The Financial Express Newspaper and
- 2. Regional Language Newspaper (Gujarati) The Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You.

For, Murae Organisor Limited (Formerly known as Earum Pharmaceuticals Limited)

Manthan Tilva Managing Director DIN: 10453462 **FINANCIAL EXPRESS**

STATE BANK OF INDIA Stressed Assets Recovery Branch (SARB - 18735) 2nd Floor, Administrative Office Building, Nilambaug Chowk, Bhavnagar, Gujarat-364 001. Phone No.0278-2514051, E-mail: sbi.18735@sbi.co.in

PUBLICATION OF NOTICE REGARDING POSSESSION OF PROPERTY U/S 13(4) OF SARFAESI ACT 2002

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the power conferred under section 13(12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 a demand notice was issued on the date mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said act read with rule 9 of the said Act on the dates mentioned against each account.

The Borrower in particular and the Public in general are in hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the STATE BANK OF INDIA, for the amount and interest thereon

The borrowers attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets

Name of Account / Borrower & Address	Name of Proprietor/ Partners/ Guarantors/ Owner of Property etc.		Date of Demand Notice	Date of Possession	Amount outstanding
Mr. Rambhai Bhagvanbhai Algotar	Mr. Rambhai Bhagvanbhai	All that piece and parcel of land and building adm 328.50 sq. mtrs. with	19/08/2023	31/03/2024 (Physical)	Rs.49,81,858.51/- as on 18/08/2023
Plot No. 25/A, Nari Gamtal, Limda Street, Old Ashram Road, Nari, Bhavnagar 364004	Algotar	proposed construction adm. 234.78 in Gamtal, limdawali street, Nari, Ta. 549 of Nari Gram Panchayat	sq. mtrs., cor		
Date : 04-04-2024		A	Authorize	ed Officer, St	ate Bank of India.

1. DESCRIPTION OF THE PROPERTY

EAST: 6.00 MTR. ROAD, WEST: PLOT NO. 25

NORTH: PLOT NO. 31, SOUTH: PLOT NO. 29

:ICIC0000024

:380229002

BRANCH NAME : JMC HOUSE, AHMEDABAD.

RS.9.00.000/- (RUPEES NINE LAKHS ONLY)

1. DESCRIPTION OF THE PROPERTY

EAST: PLOTNO: 63, WEST: SOCIETY ROAD

NORTH: SOCIETY ROAD, SOUTH: PLOT NO.21

:ICICIBANK LTD.

:ICIC0000024

:380229002

RS.9,00,000/-(RUPEES NINE LAKHS ONLY)

1. DESCRIPTION OF THE PROPERTY

RS. 90,000/- (RUPEES NINETY THOUSAND ONLY)

2. A/C NO. FOR DEPOSITING EMD/OTHER AMOUNT

ALL THAT PIECE AND PARCEL OF THE PROPERTY

BEARING FLAT NO.C/301, THIRD FLOOR, ADMEASURING

ABOUT 56.86 SQ. MTRS. ALONGWITH UNDIVIDED SHARE OF

LAND, IN SCHEME KNOWN AS 'TANKAR RESIDENCY - II

SITUATED AT REVENUE SURVEY NO.1052, 1052/1, 1052/2

1052/3, 1052/4, 1055 AND 1122, DRAFT T.P.S. NO.87 (VATVA -

VINZOL), FINAL PLOT NO.31 + 33/1 + 43/2, MOUJE VATVA, TA

DASCROI, IN THE REGISTRATION DISTRICT OF AHMEDABAD

AND SUB DISTRICT OF AHMEDABAD - 11 (ASLALI), GUJARAT.

RS. 90,000/- (RUPEES NINETY THOUSAND ONLY)

2. A/C NO. FOR DEPOSITING EMD/OTHER AMOUNT

1. ALL THAT PIECE AND PARCEL OF THE PROPERTY

BEARING PLOT NO.20 ADMEASURING 60.28 SQ. MTRS

ALONGWITH UNDIVIDED SHARE & CONSTRUCTION

THEREON IN SCHEME KNOWN AS "V. K. PARK" SITUATED

UPON NA LAND AT REVENUE SURVEY NO. 284 TO 286, BLOCK

NO.210, AT. TANTITHAIYA, TA. PALSANA, IN THE

REGISTRATION DISTRICT OF SURAT & SUB DISTRICT OF

BANASKANTHA GUJARAT

BOUNDED AS FOLLOWS:

IFSC CODE

MICR CODE

1. RESERVE PRICE

2. EMD OF THE PROPERTY

1. RESERVE PRICE (IN INR):

2. EMD AMOUNT (IN INR):

PALSANA, GUJARAT

BANK NAME

BOUNDED AS FOLLOWS:

1. RESERVE PRICE

2. EMD OF THE PROPERTY

RESERVE PRICE (IN INR):

2. EMD AMOUNT (IN INR):

BOUNDED AS FOLLOWS:

BANK NAME

IFSC CODE

MICR CODE

1. RESERVE PRICE

2. EMD OF THE PROPERTY

1. RESERVE PRICE (IN INR):

2. EMD AMOUNT (IN INR):

EAST: PASSAGE, FLAT NO.C/304,

WEST: MARGIN/OTHER BLOCK

2.ACCOUNT NO.::002405020441

NORTH: FLAT NO.C/302, SOUTH: STAIR CASE

:ICICIBANKLTD.

:ICIC0000024

:380229002

BRANCH NAME : JMC HOUSE, AHMEDABAD.

RS.7,00,000/- (RUPEES SEVEN LAKHS ONLY)

1. DESCRIPTION OF THE PROPERTY

RS. 70,000/- (RUPEES SEVENTY THOUSAND ONLY)

2. A/C NO. FOR DEPOSITING EMD/OTHER AMOUNT

ALL THAT PIECE & PARCEL OF PROPERTY BEARING SUB

PLOT NO.26/8, ADMEASURING 42.62 SQ. MTRS, AND

"MURLIDHAR PARK-2" SITUATED AT REVENUE SURVEY

NO.31/P1, ADMEASURING 16376 SQ. MTRS. AMALGAMATED

PLOT NO.26, AT MOJE: DARED, TA. JAMNAGAR, IN THE

BOUNDED AS FOLLOWS: (AS PER SALE DEED)

NORTH: SUB PLOT NO.26/7, SOUTH: PLOT NO.29

:ICIC0000024

380229002

BRANCH NAME : JMC HOUSE, AHMEDABAD.

EAST: PLOT NO.35, WEST: 7.50 MTR. ROAD

2.ACCOUNT NO. : 002405020441

IFSC CODE

MICR CODE

1. RESERVE PRICE

2. EMD OF THE PROPERTY

RESERVE PRICE (IN INR):

2. EMD AMOUNT (IN INR):

BANKNAME : ICICIBANKLTD.

2.ACCOUNT NO.: 002405020441

2.ACCOUNT NO. : 002405020441

2. A/C NO. FOR DEPOSITING EMD/OTHER AMOUNT

ALL THAT PIECE AND PARCEL OF PROPERTY BEARING

PLOT NO. 30 ADMEASURING 87.00 SQ. MTRS. 8

CONSTRUCTION THEREON SITUATED AT N.A LAND BEARING

BLOCK S. NO. 82/2 OF TANA, TALUKA - KANKAREJ, DISTRICT

Authorized Officer, State Bank of India SARB, Bhavnagar (18735)

CORRIGENDUM

advertisement published in this Newspaper on

02-April-2024 against the Borrower(s)/ Co-Borrower(s) 1. Mr. Hariomsingh Tomar 2. Mrs.

Santoshidévi (Prospect No. IL10011689 &

L10094682) in which Reserve price

Rs.11,00,000/- (Rupees Eleven Lakh Only)

EMD Amount Rs.1,10,000/- (Rupees One

Lakh Ten Thousand Only) & Bid Amount

Rs. 25,000/- (Rupees Twenty Five Thousand

Rs.9,00,000/- (Rupees Nine Lakhs Only)

EMD as Rs.90,000/- (Rupees Ninety

Thousand Only) and Bid amount as

Rs.20,000/- (Rupees Twenty Thousand

Only) All other remain same, inconvenience

Regretted

Date: 04-04-2024

Place: Gujarat

Only) Should be read as Reserve Price

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED REGISTERED OFFICE: 4TH FLOOR,

NARAYAN CHAMBERS, B/H, PATANG HOTEL

ASHRAM RAOD, AHMEDABAD - 380 009.

CONTACT PERSON: MR. BHARAT J. BHATT, MOBILE NO.97141 99018.

Place : Bhavnagar.

APPENDIX - IV-A [SEE PROVISO TO RULE 8 (6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice of the Immovable Assets under the Securitization and Reconstruction of the Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor i.e. MAS Rural Housing & Mortgage Finance Ltd. The physical possession of which has been taken by the authorized officer of MAS Rural Housing & Mortgage Finance Ltd. in the all Loan Account Nos. are mention below, with a right to sale is without any Recourse Basis" for realization of company's dues.

the same on "As is What is, As is Where is, and Whatever There
BORROWER/S & GUARANTOR/S NAME & ADDRESS TOTAL DUE + INTEREST
Loan Account No. 1216 1. VALABHAI HIRABAHI BELDAR (APPLICANT), HAVING ADDRESS AT: PO TANA, SHANTINAGAR, TA. KANKREJ-385555, DIST. BANASKANTHA, GUJARAT. 2. ASHABEN VALABHAI BELDAR (CO APPLICANT), HAVING ADDRESS AT: PO TANA, SHANTINAGAR, TA. KANKREJ-385555, DIST. BANASKANTHA, GUJARAT. 3. KALYANBHAI SAGTHABHAI THAKOR (CO-APPLICANT), HAVING ADDRESS AT: AT & PO. KOTDA (D), FH, TA, DEODAR DIST. BANASKANTHA-385330, GUJARAT. 4. AMOUNT Rs.27,37,097.00/- AS PER DEMAND NOTICE DATED 16/06/2022 + INTEREST TILL THE DATE OF REALIZATION AND COST, CHARGES AND OTHER EXPENSES.
1. DATE & TIME OF E-AUCTION

2. LAST DATE OF SUBMISSION OF EMD 3. DATE & TIME OF THE PROPERTY INSPECTION 1) E-AUCTION DATE: 06/05/2024

11:00 AM TO 01:00 PM WITH FURTHER EXTENSION OF 2) LAST DATE OF SUBMISSION OF EMD WITH KYC 03/05/2024 - TILL 05:00 PM 3) DATE OF INSPECTION: ON 02/05/2024 - BETWEEN 10:00

AM TO 05:00 PM IST 2. TOTAL DUE + INTEREST

1. BORROWER/S & GUARANTOR/S NAME & ADDRESS

Loan Account No. 2752 DINESH RAMKEVALBHAI KORI (BORROWER)

HAVING ADDRESS AT: PLOT NO.34, INDRALOK SOCIETY, NR AASPASS MANDIR, GODADRA, SURAT-394210, GUJARAT. PANCHRAM RAMKEVAL KORI (CO-BORROWER), HAVING ADDRESS AT: PLOT NO.34, INDRALOK SOCIETY, NI AASPASS MANDIR, GODADRA, SURAT-394210, GUJARAT. 3. ARJUN RAMKEVAL KORI (CO-BORROWER), HAVING ADDRESS AT: PLOT NO.34, INDRALOK SOCIETY, NO.

AASPASS MANDIR, GODADRA, SURAT-394210, GUJARAT. 4. KRISHNADEVIBEN RAMKEVALBHAI KORI HAVING ADDRESS AT: PLOT NO.34, INDRALOK SOCIETY, NR AASPASS MANDIR, GODADRA, SURAT-394210, GUJARAT. AMOUNT Rs.19,84,942.00/- AS PER DEMAND NOTICE IFSC CODE. DATED 22/11/2021 + INTEREST TILL THE DATE OF MICRODE

REALIZATION AND COST, CHARGES AND OTHER BRANCH NAME : JMCHOUSE, AHMEDABAD. EXPENSES. 1. DATE & TIME OF E-AUCTION 2. LAST DATE OF SUBMISSION OF EMD 3. DATE & TIME OF THE PROPERTY INSPECTION

1) E-AUCTION DATE: 06/05/2024 11:00 AM TO 01:00 PM WITH FURTHER EXTENSION OF MINUTES 2) LAST DATE OF SUBMISSION OF EMD WITH KYO 03/05/2024 - TILL 05:00 PM 3) DATE OF INSPECTION: ON 02/05/2024 - BETWEEN 10:00 AM TO 05:00 PM IST

1. BORROWER/S & GUARANTOR/S NAME & ADDRESS 2. TOTAL DUE + INTEREST Loan Account No. 2938 1. JULIYAS NATVARBHAI MACWAN (BORROWER), HAVING ADDRESS AT: B.NO.4/99, SATYAMNAGAR, OPP.

RABARI COLONY, NR. NAGARVEL HANUMAN, AMRAIVADI, AHMEDABAD - 380026, GUJARAT. 2. SEJAL JULIYAS MACWAN (CO-BORROWER), HAVING ADDRESS AT: B.NO.4/99, SATYAMNAGAR, OP RABARI COLONY, NR. NAGARVEL HANUMAN, AMRAIVADI,

AHMEDABAD - 380026, GUJARAT. 3. AMOUNT Rs. 5,91,249.00 AS PER DEMAND NOTICE DATED 30/06/2022 + INTEREST TILL THE DATE OF REALIZATION AND COST, CHARGES AND OTHER EXPENSES.

1. DATE & TIME OF E-AUCTION 2. LAST DATE OF SUBMISSION OF EMD 3. DATE & TIME OF THE PROPERTY INSPECTION 1) E-AUCTION DATE: 06/05/2024 11:00 AM TO 01:00 PM WITH FURTHER EXTENSION OF MINUTES

2) LAST DATE OF SUBMISSION OF EMD WITH KY 03/05/2024-TILL 05:00 PM 3) DATE OF INSPECTION: ON 02/05/2024 – BETWEEN 10:00

1. BORROWER/S & GUARANTOR/S NAME & ADDRESS

2. TOTAL DUE + INTEREST Loan Account No. 6101 1. KRISHNBIHARI UDAYBHAN GOND (BORROWER), HAVING ADDRESS AT: 2, OPP. PATEL SAMAJ ASHAPURA CONSTRUCTION THEREON IN SCHEME KNOWN AS NIVAS, NEAR VIVEKANAND SCHOOL, DARED, JAMNAGAR

2. LALASA KRISHNBIHARI GOND (CO-BORROWER). HAVING ADDRESS AT: 2, OPP. PATEL SAMAJ ASHAPURA REGISTRATION DISTRICT & SUB-DISTRICT OF JAMNAGAR. NIVAS, NEAR VIVEKANAND SCHOOL, DARED, JAMNAGAR AMOUNT Rs.8,91,263.00/- AS PER DEMAND NOTICE

DATED 17/08/2022 + INTEREST TILL THE DATE OF REALIZATION AND COST, CHARGES AND OTHER

1. DATE & TIME OF E-AUCTION 2. LAST DATE OF SUBMISSION OF EMD 3. DATE & TIME OF THE PROPERTY INSPECTION

AM TO 05:00 PM IST

1) E-AUCTION DATE: 06/05/2024 11:00 AM TO 01:00 PM WITH FURTHER EXTENSION OF 2) LAST DATE OF SUBMISSION OF EMD WITH KYC 03/05/2024 - TILL 05:00 PM 3) DATE OF INSPECTION: ON 02/05/2024 – BETWEEN 10:00

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002 The Borrowers / Co-Borrowers / Guarantors are hereby notify to pay the sum as mentioned in the demand notice along with up to date interest and ancillary expenses before the date of e-auction, failing which the property will be auctioned / sold and balance dues, if any will be recovered with interest and cost. For further detailed terms and conditions of Sale, please refer to the link https://sarfaesi.auctiontiger.net also available at MAS RURAL

HOUSING & MORTGAGE FINANCE LTD, website i.e. https://www.mrhmfl.co.in/ Date: 04.04.2023 MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD. Place: Gujarat

Authorized Officer

RS.4,50,000/- (RUPEES FOUR LAKHS FIFTY THOUSAND

RS. 45,000/- (RUPEES FOURTY FIVE THOUSAND ONLY)

OSBI STATE BANK OF INDIA

Shri Bharatbhai Hirabhai Parmar PF No. 6385265 Vijaynagar Housing Society, Near Ved Mandir, Kankaria Road.

Ahmedabad, Gujarat - 380 022. **VOLUNTARY VACATION OF SERVICE**

2nd NOTICE

It is observed that you have been absenting from duty without submitting an application for leave / despite your leave being refused/beyond the period of sanctioned leave since 15.10.2016. In this connection, we refer to our Registered A D Notice dated 04.03.2021 instructing you to report for duty and explain the reasons for your absence within 30 days of the date of the notice. It is, however, observed that you have so far not complied with the instructions contained therein.

Now that you have failed to report for duty in spite of the above notice: it is deemed that you have voluntarily vacated your service amounting to voluntary resignation from the service of the bank with effect from 03:04:2021

3. You are hereby requested to pay 3 months emoluments within 15 days of the receipt of this notice failing which the Bank will be constrained to set off the same against your terminal dues and any other amount payable to you without prejudice to recovering the full amount or part thereof by suit.

General Manager

State Bank of India

Place: Ahmedabad Date: 03.04.2024

> APPENDIX IV-A Sale Notice for sale of Immovable Property

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement)

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Property mortgaged to Indiabulls Housing Finance Ltd. [CIN: L65922DL2005PLC136029] ("Secured Creditor"), the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 22.04.2024 from 02.00 P.M. to 04.00 P.M., for recovery of Rs. 32,66,615/- (Rupees Thirty Two Lakh Sixty Six Thousand Six Hundred Fifteen only) pending towards Loan Account No. HHLSUR00471203, by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 27.03.2024 with applicable future interest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. 28.03.2024 along with legal expenses and other charges due to the Secured Creditor from MAHESHBHAI VALLABHBHAI MORADIYA and MANISHABEN MAHESH MORADIYA.

The Reserve Price of the Immovable Property will be Rs. 17,60,000/- (Rupees Seventeen Lakh Sixty Thousand only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 1,76,000/- (Rupees One Lakh Seventy Six Thousand only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

FLAT NO. 505, 5TH FLOOR, VRAJ VILLA RESIDENCY, NR. SHRADDHA DEEP SOCIETY, NR. SHYAM VILLA RESIDENCY, CAUSEWAY LINK ROAD, R. S. NO. 63 & 64, T. P. S. NO. 26 (SINGHANPOR), F. P. NO. 42, PAIKI PLOT NO. 3, SUB PLOT NO. A, SINGANPORE, SURAT - 395004, GUJARAT.

For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.indiabullshomeloans.com. For bidding, log on to www.auctionfocus.in

Date: 28.03.2024 Place: SURAT

Authorized officer Indiabulls Housing Finance Limited

GRIHUM

Authorised Officer

IIFL Home Finance Ltd.

GRIHUM HOUSING FINANCE LIMITED APPENDIX IV (See Rule 8(1))
POSSESSION NOTICE (Formerly known as Poonawalla Housing Finance Ltd.): Registered
Office:- 602, 6th Floor, Zero One IT Park,
Sr. No.79/1, Ghorpadi, Mundhwa Road, Pune-411036. (For Immovable

Whereas, the undersigned being the Authorised Officer of Grihum Housing Finance Limited (formerly known as Poonawalla Housing Finance Limited as the name Poonawalla Housing Finance Limited changed to Grihum Housing Finance Limited with effect from 17 Nov 2023 (Previously known as Magma Housing Finance Limited and originally incorporated with name of GE Money Housing Finance Public Unlimited Company) here in after referred as Secured Creditor of the above Corporate/ Register office under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred as the "said Act") and in exercise of the powers conferred under Section 13 (12 of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a demand notice below dated calling upon the below Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13 (4) of the said Act read with Rule 8 of the said rules of the Security Interest Enforcement Rules 2002 on this 31st Day of March of the Year 2024. The borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be

subject to the charge of secured Creditor the amount and interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) or

ection 13 of the Act, in respect of time available, to redeem the secured assets. Details of Property taken in possession are never below.					
Name of Borrowers	Description of Property	Possession taken Date	Date of statutory Demand Notice	Amount in Demand Notice (Rs.)	
Gaurang, Patel Manishaben Gaurangbhai	Kuber Ratna, Near Darshan Hotel, Hanshapura Village, Dabhoi Road, Ta : Dabhoi East:-Plot No. C-19, West:-Plot No. C-21, North:-Society	31/03/2024	07/06/2023	Loan No. HL/0222/H/18/100312 Rs. 2686163.45/- (Rupees Twenty Six Lacs Eighty Six Thousand One Hundred Sixty Three and Forty Five Paisas Only payable as on 07/06/2023 along with interest @ 14.5 p.a. till the realization.	
Place: Gujarat Sd/- Authorised Officer Dated: 04-04-2024 Grihum Housing Finance Limited (Formerly known as Poonawalla Housing Finance Limited)				~-	
	Name of Borrowers Patel Gaurang, Patel Manishaben Gaurangbhai	Name of Borrowers Patel Gaurang, Patel Manishaben Gaurangbhai C-19, West:-Plot No. C-21, North:-Society Road, South:-Other Property Description of Property All That Pice & Parcel of Duplex No. C-20, Kuber Ratna, Near Darshan Hotel, Hanshapura Village, Dabhoi Road, Ta: Dabhoi East:-Plot No. C-19, West:-Plot No. C-21, North:-Society Road, South:-Other Property	Name of Borrowers Patel Gaurang, Patel Manishaben Gaurangbhai See Gujarat Description of Property Possession taken Date Patel & Parcel of Duplex No. C-20, Kuber Ratna, Near Darshan Hotel, Hanshapura Village, Dabhoi Road, Ta: Dabhoi East:-Plot No. C-19, West:-Plot No. C-21, North:-Society Road, South:-Other Property See Gujarat Possession taken Date 10/103/2024 11/03/2024 11/03/2024 11/03/2024	Name of Borrowers Patel Gaurang, Patel Manishaben Gaurangbhai C-19, West:-Plot No. C-21, North:-Society Road, South:-Other Property Bossession taken Date Possession taken Date Possession taken Date Possession taken Date Possession taken Date Date of statutory Demand Notice Possession taken Date Possession taken Date Or/06/2023 31/03/2024 Or/06/2023 Sd/- Authorised Office	



SK FINANCE LIMITED

(Erstwhile - Ess Kay Fincorp Limited)

Registered Office: G 1, G 2, New Market, Khasa Kothi Circle, Jaipur, Rajasthan. AUCTION CUM SALE NOTICE

Pursuant to the possession taken by the Authorised Officer of SK Finance Limited, under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under the rules of the Security Interest (Enforcement) Rules, 2002 to recover the outstanding amount Rs. 21,78,381/ - (Rupees Twenty One Lakh Seventy Eight Thousand Three Hundred Eighty One Only) as on 21.08.2023 and further interest and other charges thereon at the contractual rates starting from 23.11.2018 till actual payment and/or realization from the Borrower namely Dilipsinh Udesinh Gohil S/o. Udesinh Gohil, and Co-borrower Premilaben Dilipsinh Gohil W/o. Dilipsinh Gohil. Loan Account No. 5350669. Residing at R/o. 250/3, Rupapura, Nr. Railway Fatak Nandesari, Landmark -Railway Fatak, Vadodara, Gujarat-391340 as per the Statutory Demand Notice, dated 22.08.2023 issued u/s. 13(2) of the SARFAESI Act, OFFERS are invited by the undersigned in sealed cover for sale by auction of immovable property/ies on AS IS WHERE IS BASIS and AS IS WHAT IS BASIS as per the particulars given hereunder:

Description of Secured Asset Reserve Price EMD Rs. All that piece and parcel of Gram Panchayat House No. 2/290/2 Situated at Rs. Rupapura Nandesari, Vadodara, which is constructed upon and which is laid 10,80,000/-,08,000/ out upon land of Gram Panchayat land of Village Rupapura of Nandesari (Rupees (Rupees Gram Panchayat, in the Registration Sub-District, Vadodara and District, Ten Lakh Ten Lakh Vadodara. The said Residential Property being House No. 2/290/2 Paiki Eighty Eight Ground Floor admeasuring 50 x 27 sq. fts. (i.e. 1350.00 sq. fts.) Built up area Thousand Thousand admeasuring 1350.00 sq. fts., The said Property is Bounded as : North : House of Vanraj Udesinh; South: House of Sumanbhai Mohanbhai; East: Only) Only) House of Rajendrasinh Gohil; West: House of Raijibhai Jesingbhai.

The undersigned shall arrange to give the inspection of the said properties through his representative/agent, to prospective buyers on 26.04.2024 between 11.00 a.m. to 3.00 p.m. The undersigned may at his absolute discretion and on request from prospective buyers, arrange to give the inspection of the said property/ies through his representative/agent to prospective buyers at any other working day between the working hours of the Finance Company.

The sealed Bids shall be sent with the words "For purchase of property in the matter of DILIPASINH UDESINH GOHIL" mentioned on the cover. The Bidder shall send sealed envelope with a demand draft/pay order of a scheduled bank for the earnest money deposit (EMD) stated above favoring "SK Finance Limited payable at Ahmedabad", addressed to the Authorized Officer of SK Finance Limited, KP Epitome, B Block, 14th Floor, Office No. 1401 & 1416, Nr. Kataria Railway Crossing, Makarba, Ahmedabad-380051 (Gujarat). So as to reach the undersigned latest by 4.30 p.m. on 30.04.2024 and the Auction / inter se bidding will take place at 2.30 p.m. on 06.05.2024 at the same place, where the bidders can remain present and revise their offers UPWARDS. On the confirmation of the auction / sale of the secured asset, the successful bidder/ purchaser should deposit 25% (including 10% of the said EMD amount) of the bidding amount on same day and the balance 75% within 15 days, failing which the Bank shall forfeit the entire amount already paid by the bidder.

Terms and Conditions: (i) Sale will strictly be on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS" and on the terms as mentioned herein and in the terms and conditions of sale, however the Authorised Officer shall have the absolute discretionary right to change or vary the terms and conditions. (iii) The particulars of Secured Assets specified in the Schedule herein above have been stated to the best of the information of the Authorised Officer, but the Authorised Officer shall not be answerable for any error, misstatement or omission in this proclamation. (iii) The secure asset will not be sold below the reserve price and sale shall be confirmed to the highest bidder. However, the Authorised Officer is not bound to accept the highest bid or any or all bids and reserves the absolute right and discretion to accept or reject any bid without assigning any reason whatsoever. (Iv) The bidders at the time of submission of bid shall produce evidence of their identity by cogent documents and if they participate in the auction in a representative capacity, the authorization/resolutions/Power of attorney etc., executed by the principal be also produced. (v) In no case the bidders will be permitted to withdraw the bids. (vi) In case the bids are rejected, Authorised Officer can negotiate with any of the bidders or other parties for sale of the properties by private treaty, (vii) All statutory dues / other dues including registration charges, stamp duty, taxes etc. shall have to be borne by the purchaser. (viii) All outgoings i.e. Municipal Taxes, Maintenance/Society charges, Electricity and Water charges and any other dues or taxes in respect of the said property shall be paid by the successful Bidder/Purchaser. (ix) The successful bidder shall deposit the entire amount of sale price, adjusting the EMD within 15 working days of the acceptance of the offer by the Authorized Officer, or within such other extended time as deemed fit by the Authorised Officer, failing which the earnest deposit will be forfeited. (x) Bids below reserve price shall be out rightly rejected. (xi) Bids submitted without original demand drafts / pay order for the EMD shall be out rightly rejected. (xii) Bank Limited or its employees will not be liable for any claims from any person in respect of the properties put for sale, (xiii) Any other encumbrances are not known to the Bank. The Authorized Officer or the Bank shall not be responsible for any charge, lien, encumbrances, or any other dues to the Government or anyone else in respect of properties Auctioned. The Intending Bidder is advised to make their own independent inquiries regarding the encumbrances on the property including statutory liabilities, arrears of property tax, electricity dues etc. (xiv) If the dues of the bank together with all costs, charges and expenses incurred by them or part thereof as may be acceptable to the bank are tendered by/on behalf of the Borrowers / Guarantor/s / Mortgagor/s, at any time on or before the date fixed for sale, the auction / sale of asset may be cancelled. The Authorised Officer reserves the right to accept any or reject all bids, if not found acceptable or to postpone/cancel/adjourn/discontinue or vary the terms of the auction at any time without assigning any reason whatsoever and his decision in this regard shall be final. (xv) The sale certificate shall be issued in the same name in which the Bid is submitted. (xvi) For further details Contact our Branch office address at SK Finance Limited, KP Epitome, B Block, 14th Floor, Office No. 1401 & 1416, Near Kataria Railway Crossing, Makarba, Ahmedabad-380051.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES The Borrower / Guarantors / Mortgagors are hereby notified to pay the sum as mentioned above along with up to date interest and ancillary expenses before the date of auction, failing which the property will be auctioned / sold and balance dues, if any, will be recovered with interest and cost.

For SK Finance Limited. Place: Ahmedabad Date: 02.04.2024 Sd/- Authorized Officer

APPENDIX IV-A

Sale Notice for sale of Immovable Property E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002. read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement)

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Property mortgaged to Indiabulls Housing Finance Ltd. [CIN: L65922DL2005PLC136029] ("Secured Creditor") the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 22.04.2024 from 02.00 P.M. to 04.00 P.M., for recovery of Rs. 11,86,799/- (Rupees Eleven Lakh Eighty Six Thousand Seven Hundred Ninety Nine only) pending towards Loan Account No. HHLBRH00465093, by way of outstanding principal, arrears (including accrued late charges) and interest til 27.03.2024 with applicable future interest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. 28.03.2024 along with legal expenses and other charges due to the Secured Creditor from SAGAR KAMALAKAR DALAVI and MANISHA YASHWANT CHAUDHARI.

The Reserve Price of the Immovable Property will be Rs. 10,15,000/- (Rupees Ten Lakh Fifteen Thousand only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 1,01,500/- (Rupees One Lakh One Thousand Five Hundred only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

FLAT NO. B-18, 2ND FLOOR, BUILDING - A/B, AKSHARDHAM APARTMENT, NR. RAGINI CINEMA, VALIYA ROAD, ANKLESHWAR, BHARUCH, GUJARAT

For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.indiabullshomeloans.com. For bidding, log on to www.auctionfocus.in

Sd/ Date: 28.03.2024 Authorized officer

Indiabulls Housing Finance Limited Place: BHARUCH



EURO INDIA FRESH FOODS LIMITED

(Formerly known as Euro India Fresh Foods Private Limited) Reg. office: A-22/1, Ichhapore GIDC, Hazira-Magdala Road, Surat-394510, Gujarat, India CIN: L15400GJ2009PLC057789. Email ID: investor@euroindiatoods.com Website: www.euroindiafoods.com Phone: 0261-2913021/3041.

Notice of the Extra Ordinary General Meeting of the Company & E-voting Information.

Notice is hereby given that Extra Ordinary General Meeting of the members of EURO INDIA FRESH FOODS LIMITED will be held on Wednesday, April 24, 2024 at Plot No. A-22/1, Ichhapore G.I.D.C., Hazira Magdala Road, Surat- 394510, Gujarat, India at 11.00 a.m. to transact the business mentioned in the Notice of the meeting sent along with the explanatory statement.

The Notice, Attendance Slip and Proxy Form has been send on April 03, 2024 to all the Members whose names appears on the Register of the Company as on March 29, 2024 The Notice of EGM is also available on the website of the company www.euroindiafoods.com and copies of the said documents are also available for inspection at the Registered Office of the Company during office hours on all days except Saturday-Sunday & Public Holidays between 11.00 a.m. to 5.00 p.m. up to the date of EGM.

Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing electronic voting facilities from a place other than the venue of EGM ('remote e-voting') provided by Kfin Technologies Limited, on the resolution set forth in the EGM Notice. The details of remote e-voting are given below:

 The remote E-voting period commences on Sunday, April 21, 2024 at 10.00 a.m. and end on Tuesday, April 23, 2024 at 5.00 p.m. The remote Evoting module shall be disabled for voting thereafter.

The voting right of the Members shall be in proportion to their shares of the Paid-up Equity Shares Capital of the Company as on the cutoff date being Wednesday, April 17, 2024.

 If any person becomes the Member of the Company after the dispatch of EGM Notice but on or before the cutoff date i.e. April 17, 2024; may write for to requesting the User ID and Password on the Email ID: evoting@kfintech.com or cs@euroindiafoods.com

Once the vote on a resolution is cast by Member, the Member shall not be allowed to change it subsequently.

The Members who cast their vote electronically shall attain the EGM but shall not be entitled to cast their vote again.

In case of any queries or issue on remote e-voting, you may refer the FAQ's and e-voting manual available on Kfin Technologies Private Limited website. For EURO INDIA FRESH FOODS LIMITED

Place: Surat Javnika Gandharva

Date: April 03, 2024

Company Secretary & Compliance Officer

MURAE ORGANISOR LIMITED (Formerly known as Earum Pharmaceuticals Limited)

CIN: L24230GJ2012PLC071299

Regd. Office: A-1311, Sun West Bank, Ashram Road, Ashram Road

P.O, Ahmedabad, City Taluka, Gujarat, India - 380 009 NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the Extra Ordinary General Meeting ("EGM") of the Members of the Company will be held on Wednesday, 24th April, 2024 at 2:00 P.M. through Video Conferencing (VC) / Other Audio Video Means (OAVM) to transact the special businesses as

EGM will be held through VC/OAVM without physical presence of the Members and in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('the Act") read with rules made thereunder and Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021 and all other relevant circulars issued from time to time issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations) and Circular dated May 12, 2020 issued by Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the business as set out in the Notice of the EGM. Members attending the EGM through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. In compliance with the above circulars, the EGM Notice has been electronically sent on Monday, 1st April, 2024 to those Members whose names appeared in the Register of Members / Register of Beneficial owners as on close of business hours on Friday, 29th March, 2024 and who have registered their email addresses with the Depository Participants or with the Registrar & Share Transfer Agent of the Company ("R&T Agent") or with the Company. The Notice of the EGM is also available on the Company's website at www.earumpharma.com,website of stock exchange i.e. BSE Limited at www.bseindia.com and on website of e-voting facility provider i.e. National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

Manner of updating e-mail address is a blow:

Date: 01/04/2024

Place: Ahmedabad

Members holding shares in Dematerialized mode, who have not registered/updated their email addresses with their Depository Participants, are requested to register/update their email addresses with their respective Depository Participants with whom they maintain their

a) The Company has provided the facility to the Members to cast their vote on the matters set forth in EGM Notice, either by way of "remote e-voting" facility, prior to the EGM or by way of electronic voting system during the EGM. The instructions for joining the EGM and the manner of participation and voting are provided in the Notice of the EGM.

The manner of voting by the Members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email address, facility for voting shall be exercised through electronic means at EGM.

A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Wednesday, 17th April, 2024 only shall be entitled to avail the facility of remote e-voting or participation

at the EGM and voting through electronic voting system thereat.) The remote e-voting will commence on Sunday, 21th April, 2024 at 9:00 A.M. (IST) on and be concluded on Tuesday, 23rd April, 2024 at 5:00 P.M. (IST).

 Any Person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of notice of EGM and who holds Shares of the Company as of cut-off date i.e., 7th February, 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if holder is already registered with NSDL for remote e-voting then the use of existing user ID and password for casting the vote shall work.

E-voting shall not be allowed beyond Tuesday, 23rd April, 2024 at 5:00 P.M. (IST). g) Further the facility for voting through electronic voting system will also be made available during the EGM, to the Members who are attending the EGM and have not already cast their vote(s) through remote e-voting.) Members who have cast their vote by remote e-voting may also attend the EGM, but shall

not be allowed to vote again at the EGM. If any Member wishes to get a printed copy of the EGM notice, the Company shall send the

same, free of cost, upon receipt of request from the Member. Aperson, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail

the facility of remote e-voting; n case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a

request at evoting@nsdl.co.in. Members are requested to carefully read all the Notes set out in the Notice of the EGM and in particular, instructions for joining the EGM, manner of casting vote through remote e-voting or through electronic voting system during the EGM.

For, Murae Organisor Limited (Formerly known as Earum Pharmaceuticals Limited) Manthan Tilva

DIN: 10453462

Ahmedabad

Managing Director

financialexp.epapr.in

NOTICE FOR LOSS OF SHARE CERTIFICATE
I, NAGARATHNAMMA (PAN AEFPN3093P), holding 720 shares of Face Value Rs. 1/- in United Breweries Limited having its registered office at UB Tower, UB City 424 Vittal Mallya Road, Bengaluru, Karnataka, 560001 in Folio UB079386 bearing Share Certificate Number 108269 with Distinctive Numbers from 3363041 - 3363760. In hereby give notice that the said Share Certificate(s) are lost and I have applied to the Company for issue of duplicate Share Certificate. The public is breeby warned against ourchasing ertricates), and of duplicate Share Cerumanion for issue of duplicate Share Cerumanion for expension of dealing in anyway with the said Share Certificates.

retriticates. he Company may issue duplicate Share iertificates if no objection is received by the company <u>within 15 days</u> of the publication of this dvertisement, after which no claim will be ntertained by the Company in that behalf.

મુરે ઓર્ગેનાઇઝર લીમીટેડ

(પહેલા ઓરમ ફાર્માસ્થુટીકલ્સ લીમીટેડ તરીકે જાણીતી) (CIN : L24230GJ2012PLC071299) સરનામું : એ–૧૩૧૧, સન વેસ્ટ બેંક, આશ્રમ રોડ, પી.ઓ.અમદાવાદ, સીટી તાલુકો, ગુજરાત–૩૮૦ ૦૦૯

અસાદ્યારણ સામાન્ય સભાની નોટીસ અને રીમોટ ઈ–વોટીંગ માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની અસાધારણ સામાન્ય સભા (ઈજીએમ) બુધવાર ર૪ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે વિડિયોકોન્ફરન્સીંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફત ઈજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે ચો<mark>ં</mark>જાશે. ઈજીએમ કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ)ની લાગુ જોગવાઇઓ સાથે વંચાતા તે હેઠળ બનેલ નિયમો અને કોર્પોરેટ અફેર્સ મત્રાલચ દ્વારા સમચાંતરે જારી કરાચેલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ **૦**૮ એપ્રિલ.૨૦૨૦, સરક્યલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ. ૨૦૨૦ અને ત્યારબાદ કોર્પોરેટ અર્કર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સરક્યુલર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૦૫ મે, ૨૦૨૦ અને સરક્યુલર નં. ૦૨/૨૦૨૧ તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ અને અન્ય તમામ સંબંધિત સરક્યુલર (એમસીએ સરક્યુલરો) અને સિક્ચોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ)નિયમનો, ૨૦૧૫(લિસ્ટીંગ નિયમનો)અને સિક્ચોરીટીઝઅને એક્સચેન્જબોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સરક્યુલર તારીખ ૧૨ મે, ૨૦૨૦ (સેબી સરક્યુલર)ના અનુપાલન હેઠળ સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર વીસી/ઓએવીએમ મારફત ઈજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે વપરાશે. વીસી/ઓએવીએમ મારફત ઈજીએમમાં હાજર રહેનાર સભ્યોને એક્ટની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે.

ઉપરોક્ત સરક્યુલર અંતર્ગત, ઈજાએમની નોટીસ તમામ સભ્યો જેના નામો શુક્રવાર, ૨૯ માર્ચ, ૨૦૨૪ ન રોજ કામકાજના કલાકો પુરા થતાં રજીસ્ટર ઓફ મેમ્બર્સ/લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં હાજર છે અને જેમણે ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો અથવા કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરએન્ડ ટીએજન્ટ) અથવા કંપનીમાં તેમના ઈમેઇલ એડ્રેસો રજીસ્ટર્ડ કરાવેલ છે તેઓને સોમવાર, ૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ઇલેક્ટ્રોનિકલી મોકલેલ છે. ઇજીએમની નોટીસ કંપનીની વેબસાઇટ www.earumpharma.com, સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ લીમીટેડની વેબસાઇટ www.bseindia.com અને ઇ–વોટીંગ સર્વિસપ્રદાતા એટલે કે નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ) ની વેબસાઈટ એટલે કે www.evoting.nsdl.com ઉપર ઉપલબ્ધ છે ઈમેઈલ એડ્રેસ સુધરાવવાની રીત નીચે છે:

ડિમટીરીયલાઇઝેડ સ્વરૂપે શેર હોલ્ડીંગ ધરાવતા સભ્યો, જેમણે તેના ડિપોઝીટીરી પાર્ટીશીપન્ટો પાસે તેમના ઈમેઈલ એડ્રેસો રજીસ્ટર્ડ/સુધારો કરાવેલ નથી તેઓને તેમના સંબંધિત ડિપોઝીટીરી પાર્ટીશીપન્ટો જેના પાસે તેઓ તેમના ડિમેટ એકાઉન્ટનું સંચાલન કરે છે તેની પાસે તેમના ઈમેઈલ એડ્રેસો રજસ્ટર/સુધારે કરાવા વિનંતી છે.

એ) કંપની તેના સભ્યોને ઈજાએમ ની નોટીસમાં જગાવેલ કાર્યો પર ઈજાએમ પહેલા રીમોટ ઈ–વોટીંગ સવલત અથવા ઈજાએમ દરમિયાન ઈલેક્ટોનિક વોટીંગ સીસ્ટમના માર્ગે તેના મત આપવાની સવલત આપી રહી છે. ઈજાએમમાં જોડવા માટેની સરાનાઓ અને ભાગ લેવાની અને મત આપવાની રીત ઈજાએમની નોટીસમાં આપેલ છે.

બી) ડીમટીરીચલાઈઝડ, ફીઝીકલ સ્વરૂપે શેર હોલ્ડીંગ ધરાવતા સભ્યો અને જે સભ્યોએ તેમના ઈમેઈલ એડ્રેસ ૨જીસ્ટર્ડ કરાવેલ નથી તેવા સભ્યોએ મત આપવાની રીત, મતદાનની સવલત ઈજીએમ ખાતે

ઇલેક્ટ્રોનિક માધ્યમો મારફત આપવામાં આવશે. સી) જે વ્યક્તિનું નામ કટ-ઓફ તારીખ એટલે કે બુધવાર ૧૭ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાચેલ છે, ફક્ત તેઓ જ રીમોટ ઇ-વોટીંગની સવલત મેળવવા અને ઈજાએમમાં ભાગ લેવા અને ઇલેક્ટ્રોનિક વોટીંગ

પદ્ધતિનો ઉપયોગ કરીને મત આપવા માટે હકદાર ગણાશે. **ડી)** રીમોટ ઈ-વોટીંગ રવિવાર, ૨૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે અને મંગળવાર ર૩ એપ્રિલ, ૨૦૨૪ ના રોજસાંજે૫:૦૦ વાગ્યે પુર્ણ થશે.

ઇ) ઈજીએમની રવાનગી પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનનાર અને કટ ઓફ તારીખ એટલે કે ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ શેર હોલ્ડીંગ ધરાવતી કોઇપણ વ્યક્તિ evoting@nsdl.co.in ને અરજ઼ મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જોકે જો હોલ્ડર પઢેલેશી રીમોટ ઈ–વોટીંગ માટે એનએસડીએલમાં ૨જ઼સ્ટર્ડ છે. તો તેઓ તેમના વર્તમાન યૂઝર આઈર્ડ અને પાસવર્ડનો મત આપવા માટે ઉપયોગ કરી શકે છે.

એફ) ઈ-વોટીંગ મંગળવાર, ૨૩ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા પછી માન્ય ગણાશે નહી. ુજી) આ ઉપરાંત ઈજીએમમાં હાજર રહેનાર અને રીમોટ ઈ-વોટીંગ મારફત જે સભ્યોએ તેના મત(તો) . આપેલ નથી તેવા સભ્યોને ઇલેક્ટ્રોનિક વોટીંગ પદ્ધતિ મારફત મતદાનની સવલત ઈજીએમ દરમિયાન પણ ઉપલબ્ધ રહેશે.

એચ) જે સભ્યોએ રીમોટ ઈ–વોટીંગ થી મત આપેલ છે તેઓ ઈજીએમમાં પણ હાજર રહી શકે છે, પંરતુ ઈજીએમ ખાતે ફરીથી મત આપવાની પરવાનગી મળશે નઠી.

આઈ) જો કોઈ સભ્યને ઈજીએમ નોટીસની પ્રિન્ટેડ નકલ જોઈતી હોય તો, કંપની સભ્યો પાસેથી અરજી મળતા તે વિના મુલ્ચે મોક્લશે.

જે) જે વ્યક્તિનું નામ કટ–ઓફ તારીખના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા લાભાર્થી માલિકોન રજીસ્ટરમાં નોંધાચેલ છે ફક્ત તેઓજ રીમોટ ઈ–વોટીંગની સવલત મેળવવા હકદાર ગણાશે.

કોઈપણ પૂછપરછ માટે તમે www.evoting.nsdl.com ના ડાઉનલોડ સેક્શનમાં ઉપલબ્ધ શેર હોલ્ડર માટેના વારંવાર પુછાતા પ્રશ્નો (એફએક્યુએસ) અને ઈ–વોટીંગ યુઝર મેન્યુઅલ જોવા અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ ઉપર કોલ કરવો અથવા evoting@nsdl.co.in ને અરજી મોકલવી.

સભ્યોને ઈજાએમની નોટીસમાં જણાવેલ તમામ નોંધો અને ખાસ કીરને ઈજીએમમાં જોડવાની સુચનાઓ રીમોટ ઈ-વોટીંગ અથવા ઈજાએમ દરમિયાન ઇલેક્ટોનિક મતદાન પત્કતિ મારકત મત આપવાની રીત મુરે ઓર્ગેનાઇઝર લીમીટેક, માટે ધ્યાનથી વાંચવા વિનંતી છે. (પહેલા ઔરમ ફાર્માસ્થુટીકલ્સ લીમીટેડ તરીકે જાણીતી)

તારીખ : ૦૧.૦૪.૨૦૨૪

સ્થળ : અમદાવાદ

મંથન તિલ્લા મેનેજિંગ ડાયરેક્ટર ડીઆઇએન: ૧૦૪૫૩૪૬૨

AKM CREATIONS LTD

(Formerly known as AKM Lace and Embrotex Limited)

Registered Office: C-110, G/F, Bhola Nath Naoar, Shahdara, East Delhi – 110032 CIN: L17291DL2009PLC196375.

NOTICE OF POSTAL BALLOT & E-VOTING

Members of the Company are hereby informed that pursuant to Section 108 and Section 110 of the Companies Act, 2013 ("the Act") read with the Rule 20 and Rule 22 of the Companies (Management and Administration), Rules, 2014 read with the General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 18, 2020, General Circular No. 22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020, General Circular No. 2016 dated September 2 dated June 13, 200, General Circular No. 33/2020 dated september 28, 2020, General Circular No. 39/2020 dated December 31, 2020, General Circular No. 10/2021 dated June 23, 2021 and General Circular No. 20/2021 dated December 8, 2021 and 03/2022 dated 5th May, 2022, 11/2022 dated December 28, 2022 in relation to extension of the framework provided in the aforementioned circulars upto 30th September, 2023 issued by the Ministry of Corporate Afric ("MCA") (hereinafter collectively referred to as "MCA Circulars") and Regulation 44 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 201 and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015
("Listing Regulations"), and other applicable provisions, including any Statutory modifications or re-enactment thereof for the time being in force and as mentioned from time to time) a Postal Ballot Notice, seeking consent of the members on the resolutions as set out in the said Notice has been sent electronically to the members whose e-mail addresses are registered with the Depository Participants/ Registrar & share transfer agent i.e. Skyline Financial Services Private Limited, as on Friday, 29th March, 2024 (Cut-Off Date), seeking approval of the shareholders of the Company by Postal Ballot through electronic means, for the following matters:

l	Sr. No.	Description of Resolution	(Ordinary/ Special)
	1	Change in name of the Company from "AKM Creations Limited" to "Aayush Art and Bullion Limited" consequent change in Memorandum and Articles of Associations of the Company	Special Resolution
	2	Regularization Mr. Mahavir Rameshchandra Chudasama (DIN: 10429758) as Non-Executive - Independent Director of the Company	Special Resolution
I	3	Regularization Mr. Pradipbhai Rathod (DIN: 10429763) as Non- Executive - Independent Director of the Company	Special Resolution
	4	Approval for appointment of Mr. Maulik Rajendrabhai Shah (DIN: 07578813) as director of the company to be designated as Managing Director	Special Resolution
	5	Regularization of Mr. Piyush Parmar (DIN: 09634827) as Non-Executive Director of the Company	Ordinary Resolution
ŀ		· •	

The dispatch of the said notice through emails has been completed on Wednesday April 03rd, 2024. The Postal Ballot Notice is available on the Company's website at www.akmlace.com and on the relevant section of website of the Stock Exchanges, i.e., Bombay Stock Exchange ("BSE") and on the website of National Securities Depository Limited (NSDL) https://nsdl.co.in/. Members who have not received the Postal Ballot Notice may download it from the above-mentioned websites. Members holding shares either in physical form or dematerialized form, as on the Cut-off Date i.e. Friday, 29° March, 2024, may cast their vote electronically on the business term as set out in the potice of the nostal ballot through electronic voting system (rempte e-voting) of National Securities notice of the postal ballot through electronic voting system (remote e-voting) of National Securities Depository Limited (NSDL). The members are further informed that:

- a) The Special businesses as set out in the notice of the postal ballot are to be transacted through
- voting by electronic means only. b) The remote e-voting begins at 09:00 A.M. (IST) on Thursday. April 04th, 2024 The remote e-voting ends at 05:00 P.M. (IST) on Friday, May 03rd, 2024.
- d) The Cut-off Date for determining the eligibility to vote by electronic means is Friday. March 29 e) The members may note that (i) the remote e-voting module shall be disabled for voting and the voting by electronic means shall not be allowed after the date and time mentioned under point
- 'c' above; and (ii) once the vote on a resolution is cast by a member, the member shall not be allowed to change it subsequently; The manner of remote e-voting for members holding shares in physical mode or dematerialized mode or who have not registered their email addresses with the Company / Depository
- Participant, is provided in the notice of the postal ballot and available on the Company's website at www.akmlace.com
- g) Manner of registering/updating email address:
- Members, holding shares in physical mode are requested to get their email ids registered by visiting the following link: www.akmlace.com
- ii. Members, holding shares in dematerialized mode are requested to register / update their email ids with their respective Depository Participants.
-) For any grievance regarding e-voting, the members may write at NSDL email ID https://www.evoting.nsdl.com or contact at 1800 1020 990 /1800 224 430. Further, for e-voting queries, shareholders may refer the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available for them at the download section of https://www.evoting.nsdl.com o call at the toll-free no.: 1800 1020 990 /1800 224 430

For and on behalf o AKM Creations Limited (Formerly known as AKM Lace and Embrotex Limited)

Jagrutiben Deepakbhai Parma

OFFER TO BUY/SELL QUOTED SHARES

We and our clients are interested in buying / Selling quoted (listed) equity shares at an attractive price, kindly contact us if anyone is interested in selling / buying at this time or any time in future so that we can help you to get good returns for your investment.

Kindly email us on nyraadvisory@gmail.com for further communication. Nyra Advisory

ROTOCOL MARINE SERVICES PRIVATE LIMITED (IN LIQUIDATION) **nunication Address-** Contact:106, 1st Floor, Kanakia Atrium 2, nd Courtyard Marriott, Chakala, Andheri East, Mumbai - 40<u>009</u>3

> E -AUCTION - SALE OF ASSETS UNDER IBC. 2016 Date and Time of Auction: 2 May 2024 at 12:00 P.M. to 1:00 P.M. (with unlimited extension of 5 minutes each)

Sale of Assets owned by Protocol Marine Services Private Limited (In Liquidation forming part of Liquidation Estate under section 35(f) of IBC 2016 read with regulation 32 & 33 of IBBI (Liquidation Process) Regulations, 2016. E-Auction will be conducted on **"AS IS** WHERE IS", "AS IS WHAT IS BASIS", "WHATEVER THERE IS BASIS" AND NO RECOURSE

he Sale will be done by undersigned through e-auction service provider National E Governance Services Limited via website https://nesl.co.in/auction-notices-under-ibc/

Amount in				
Sr No	Particulars	Reserve Price	EMD	Incremental Bid Amount
1	Office No. A-1502, 15th Floor, Universal Majestic, P. L. Lokhande Road, Behind RVK International School, CTS No. 4A/8/1, Village Borla, Chembur West, Mumbai – 400043 (Area ~354.69 sq metres) with 4 stack car parking spaces (total 8 car parking spaces) along with Office Equipment (Underregulation 32(d) of Liquidation Regulations, 2016)	INR 14,25,00,000	INR 1,42,50,000	INR 1,40,000

ast date for Inspection 25th April 2024 (Thursday) : 29th April 2024 (Monday) up to 5:00 PM Last date of EMD submission 2th May 2024 (Thursday) at 12:00 P.M. to 1:00 P.M. ate and time of E-Auction Note: The detailed Terms & Conditions, E-Auction Bid Document, Declaration & other details

of online auction sale are available on https://pda.nesl.co.in n case of any clarifications, please contact the undersigned protocolmarine.cirp@gmai

Date: 4th April 2024 Harish Kant Kaushil Liquidator of Protocol Marine Services Pvt Ltd Vide NCLT order dated 4 December 2023 Communication Address: 106, 1st Floor, Kanakia Atrium 2, Cross Road A, Behind Courtyard Marriott, Chakala, Andheri East, Mumbai - 400093

Email: protocolmarine.cirp@gmail.com

Reg. No. IBBI/IPA-001/IP-P01469/2018-2019/12340

Authorization for Assignment valid till 29th November 2024

TRIVENI TURBINE LIMITED

Corporate Indentity Number: L29110UP1995PLC041834
Regd. office: A-44 Hosiery Complex, Phase II Extn, Noida-201305, Uttar Pradesh Corp. Off: 8th Floor, Express Trade Towers, 15-16, Sector - 16A, Noida, U.P. - 20130 Website: www.triveniturbines.com , E-mail : shares.ttl@trivenigroup.com Phone: 91 120 4308000 / Fax: 91 120 4311011

NOTICE OF POSTAL BALLOT

Members of the Company are hereby informed that pursuant to the provisions of Sectic 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("Act") read with Rule nos. 20 and 22 of the Companies (Management and Administration) Rules 2014, as amended from time to time ("Rules") read with General Circular No. 14/2020 dated April 8, 2020 and Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 9/2023 dated September 25, 2023 and other applicable Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), Secretarial Standard on General Meetings ("SS-2") and other applicable laws, rules and regulations (including any statutory modification or re-enactment thereo for the time being in force), Triveni Turbine Limited ("Company") has on April 03, 2024 completed dispatch of Postal Ballot Notice dated March 30, 2024 ("Notice" electronically to those members whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from the National Securities Depository Limited (NSDL) and Central Depository Securities (India) Limited (CDSL) and whose e-mail addresses are available with the Company/Denositories as on Friday, March 29, 2024 ("Cut-Off Date") for seeking approval of the Company's Members by way of special resolution on the following items by remote e-voting process :

- Appointment of Mrs. Sonu Halan Bhasin (DIN: 02872234) as an Independe Director on the Board of Directors of the Company
- Appointment of Mrs. Amrita Gangotra (DIN: 08333492) as an Independent Directo on the Board of Directors of the Company
- Re-appointment of Mr. Dhruy M. Sawhney (DIN: 00102999) as Managing Director The voting rights of the Members/Beneficial Owners shall be in proportion to their shareholding of the paid-up equity share capital of the Company as on the Cut-Off date. Members whose names appear on the Register of Members / List of Beneficial owners as on the Cut-off Date will only be considered eligible for the purpose of remote e-voting. *F* person who becomes a member after the cut-off date should treat this notice for

information purpose only. The Postal Ballot Notice is also available on the Company's website at www.triveniturbines.com, website of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com & National Stock Exchange of India Limited at www.nseindia.com espectively and on the website of NSDL at www.evoting.nsdl.com.

Please note that there will be no dispatch of Physical copies of Notices or Postal Ballo forms to the members of the Company. Members desirous of exercising their votes through the remote e-voting process are requested to carefully read the instructions indicated in this notice and record their Assent (FOR) Dissent (AGAINST) only through emote e-voting system. Members are requested to carefully read all the notes set out in the Postal Ballot Notice and in particular the manner of casting vote through remote

Instructions for e-voting

The remote e-voting shall commence on April 04, 2024 at 9.00 A.M. (IST) and shall end o May 3, 2024 at 5.00 P.M. (IST). During this period, the members of the Company holding shares in physical or electronic forms on the Cut-Off date may cast their votes electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting mmediately thereafter.

Members who have not yet registered their e-mail addresses are requested to register the same with their respective depository participant in case the shares are held in electronic form and with the Company's registrar M/s. Alankit Assignments Limited as detailed in notes to the Postal Ballot notice

Manner of registering / updating email addresses is as below:

- Members holding shares in physical mode, who have not registered / updated their email addresses with the Company are requested to register / update their e-mail address by providing Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) by email to rta@alankit.com.
- Members holding shares in dematerialized mode, who have not registered / update their email addresses with their Depository Participants, are requested to register update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts. After due verification, NSDL (e-Voting Service Provider) will forward their login credentials to their registered email address.

n case of any queries, member may write to rta@alankit.com

The Board of Directors of the Company has appointed Mr. Kapil Dev Taneja, Partne failing him Mr. Neeraj Arora, Partner of Sanjay Grover & Associates, Company Secretaries as the Scrutinizer for conducting the Postal Ballot process through remote e voting in a fair and transparent manner.

The results of the voting conducted by the Postal Ballot along with the Scrutinizer's report will be announced by the Chairman and Managing Director/Vice Chairman and Managinç Director, or in their absence to the Company Secretary on or before May 07, 2024. The results will be made available on Company's website at www.triveniturbines.com, the websites of the Stock exchanges, namely BSE Limited and the National Stock Exchange of India Limited, at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of NSDL www.evoting.nsdl.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the downloa section of www.evoting.nsdl.com or contact NSDL, 4th Floor, A-Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013 or call at 022-4886 7000 and 022-2499 7000 or send a request to Ms. Pallavi Mhatre, Senic Manager -NSDL at evoting@nsdl.com.

For Triveni Turbine Limited

Pulkit Bhasii

Company Secretar

Place: Noida (U.P.) Membership No. A2768 Date: April 03, 2024

UCO BANK
(A Govt. Of India Understation यूको बैंक પઝેશન નોટીસ OURS YOUR TRUS

રીલીફ રોડ શાખા : રોયલ ચેમ્બર્સ, ઘી કાંટા ક્રોસ રોડ, રીલીફ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧ આથી નીચે સહી કરનાર **યુકો બેંક** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ (નં. ૫૪ ઓફ ૨૦૦૨) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૩ સહિત વંચાતી કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૧૦.૦૧.૨૦૨૪ ના રોજ ઉધારકર્તા/જામીનદાર (૧). મે. સનરાઈસ સ્ટ્રીલ પ્રોપ્રાઈટર સંદિપકુમાર **નટવરલાલ પટેલ** ને માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાના ૬૦ દિવસોની અંદર રૂા. ૧,૫૨,૬૪,૩७૯.૩૬ (રૂા. એક કરોડ બાવન લાખ ચોસઠ હજાર ત્રણસો ઓગણસિત્તેર અને **છાસઠ પૈસા પુરા)** (મૂળ ૨કમ રૂા. ૧,૫૦,૦૦,૦૦૦/- વત્તા વ્યાજની ૨કમ રૂા ૨,૬૪,૩૭૯.૩૬) તા. ૩૧.૧૨.૨૦૨૩ ના સુધી ના અને અન્ય ચડત વ્યાજ અને બેંક ચાર્જીસ વગેરે સાથે ચુકવવા જણાવેલ.

ઉધારકર્તા સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉધારકર્તા તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ ની કલમ - ૧૩ ની પેટા કલમ (૪) અંતર્ગત નિયમ ૮ સાથે વંચાણે લેતાં આપેલી સત્તાની રૂએ અદ્યોહસ્તાક્ષરીએ તા. ૦૨.૦૪.૨૦૨૪ ના રોજ નીચે જણાવેલ મિલકતનો કબજો લઇ લીધેલ છે.

ઉધારકર્તા વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ મિલકર્ત અંગે કરેલો કોઈપણ વ્યવહાર યુકો બેંક ની રકમ રૂા. ૧,૫૨,૬૪,૩७૯.૩૬ (રૂા. એક કરોડ બાવન લાખ ચોસઠ હજાર ત્રણસો રૂા. ૨,૬૪,૩૭૯.૩૬) તા. ૩૧.૧૨.૨૦૨૩ ના સુધી ના અને અન્ય ચડત વ્યાજ અને બેંક ચાર્જીસ વગેરે સાથેના બોજાને સહિત રહેશે.

સરફેસી કાયદાની કલમ ૧ ૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉધારકર્તાઓ અને / અથવા જામીનદારોની મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

તમામ ભાગ અને હિસ્સા સાથેની સ્થાવર મિલકતનો ટાઈટલ ડીડ નં. ૩૦૮૭૧/૩૨/૨૦૨૨ ફલેટ નં. એ-૬૦૪, શિલ્પ સેનેટરી, શીવા બ્લેશીંગની પાસે, સ્વાગત ફલેમિંગોની પાછળ, સરખેજ ગાંધીનગર હાઈવે, સરગાસણ, ગાંધીનગર - ૩૮૨૪૨૧, ગુજરાત. **ચતુઃસીમા** :**- પૂર્વે** : ફલેટ નં. એ-૬૦૩**, પશ્ચિમે** : ગાર્ડન અને બ્લોક નં. બી, **ઉત્તરે** : ફલેટ નં. એ-૬૦૧, **દક્ષિણે** : માર્જીન જગ્યા અને શીવા બ્લેશીંગ - ૧.

તારીખ : ૦૨.૦૪.૨૦૨૪, સ્થળ : અમદાવાદ

અધિકૃત અધિકારી, ચુકો બેંક

પરિશિષ્ટ IV-એ. સ્થાવર મિલકતના વેચાણ માટે સૂચના સિક્યોરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ 2002ના નિયમ 8(6) અને નિયમ 9(1) મુજબ

सिड्योरिटाઈछेशन એन्ड रिङन्स्ट्रड्शन ऒइ इछिनान्शियस એसेट्स એन्ड એन्डोर्समेन्ट जो સિક્યોરીટી ઈન્ટેસ્ટ એક્ટ **2002** हेहળ સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ-ઓક્શન વેચાણ સચના. આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને કર્જદાર(રો) અને ગૅરંટર(રો)ને સચના આપવામાં આવે છે કે, નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકત કે જે **ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિ. [CIN** L65922DL2005PLC136029] ("સીક્યોર્ડ ક્રેડિટર") પાસે ગીરવે મુકેલ છે જેનો વાસ્તવિક કબજો સીક્યોર્ડ ક્રેડિટરના અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે તે રૂ. 84,07,652/- (રૂપિયા ચોર્ચાસી લાખ સાત હજાર છસો બાવન પૂરાં) ની વસૂલી માટે 22.04.2024 ના રોજ બપોરે 2.00 થી **સાંજના 4.00 વાગ્યા** દરમિયાન **''જેમ છે^{ં''. ''}જયાં છે^{''}', ''જેમ છે જે છે''** અને જે પણ જયાં છે દ્યોરણે વેચવામાં આવશે, જે **દેમાંગ જીતેન્દ્ર મહેતા અને મહેતા અમિતા** પાસેથી **લોન અકાઉન્ટ નં** HHLAME00357831 માં બાકી નીકળતી મૂળ રકમ, એરીઅર્સ (જમા થયેલા લેટ ચાર્જિસ સહિત) તેર ૪ **27.03.2024** સુધીનાં વ્યાજ સહિત લોન એગ્રીમેન્ટ અને અન્ય સંબંધિત લોન દસ્તાવેજ(ર્જો)ન શરતો મુજબ **28.03.2024** થી અમલી બને તેમ લાગુ ભાવિ વ્યાજ ઉપરાંત કાનૂની ખર્ચ અને અન્ય યાર્જિસ સહિત સીક્યોર્ડ ક્રેડિટર્સને ચૂકવવાના બાકી નીકળે છે.

સૂચિત પ્રોપર્ટીઓના ઓક્શન માટે અનામત કિંમત **રૂ. 45,00,000/- (રૂપિયા પિસ્તાલીસ લાખ પૂરાં)** છે. અને અર્નેસ્ટ મની ડિપોઝિટ **(''ઈએમડી'') રૂ. 4,50,000/- (રૂપિયા ચાર લાખ પચાસ દજાર** પૂરાં) એટલે અનામત મૂલ્ય 10 % ના બરાબર રહેશે

સ્થાવર મિલકત્તનું વર્ણન

રહેણાક મિલકત જે ક્લેટ નં. એ / 1001, 10મા માળે આવેલ છે અને 135 ચો.વાર એટલે કે 112.87 ચો. મીટર વિસ્તાર સાથે મૌજે ગામ જોધપુર સિમ રેવેન્ચૂ સર્વે નં. 146 સ્થિત જમીનમાં અવિભાજિત હિસ્સો (જૂનો મૌજે વેજલપુર સર્વે નં. 240/1) ધરાવે છે, જે ટી. પી. સ્ક્રીમમાં સામેલ છે જેને એફ. પી. નં. 40/1 આપેલ છે, અને જે 950 ચો. મીટર વિસ્તાર ધરાવવા સાથે ''શ્રી ગણેશ ઑનર્સ એસોસિએશન", વૈભવ ટાવર "વિભાગ-1" પર આવેલ હોઈ શહેર તાલુકા (અમદાવાદ શહેર પશ્ચિમ) પેટા જિલ્લો અમદાવાદ-4 (પાલડી) ખાતે રજિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, અમદાવાદ 380051**, ગુજરાતમાં સ્થિત છે.** સીમાઓઃ

ટાવર - બી પૂર્વમાં : પશ્ચિમમાં : ફ્લેટ નં. એ / 1002 દક્ષિણમાં : કોમન પ્લૉટની બાજુ ઉત્તરમાં : લિફ્ટ અને દાદરાંની જગ્યા કપા કરીને વેચાણના વિગતસર નિચમો અને શરતો માટે સલામત લેણદાર ની વેબસાઈટ એટલે લિંક

vww.indiabullshomeloans.com નો સંદર્ભ લો. અને બિર્ડિંગ માટે www.auctionfocus.i નો સંદર્ભ લો. અધિકૃત અધિકાર્ર તારીખ: 28.03.2024 ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનોન્સ લિમિટેડ

પરિશિષ્ટ IV-એ, સ્થાવર મિલકતના વેચાણ માટે સૂચના

સેક્યોરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ) એક્ટ **2002**ના નિયમ **8**(6) અને નિયમ **9(1)** મુજબ सेड्योरिटाएं अशन अन्ड रिडन्स्ट्रड्शन ओइ इार्टनान्शियस એसेट्स એन्ड એन्झेर्समेन्ट ओइ સેક્ચોરીટી ઈન્ટ્રેસ્ટ એક્ટ **2002** હેઠળ સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ⁻ઓક્શન વેચાણ સૂચના. આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને કર્જદાર(રો) અને ગૅરંટર(રો)ને સૂચના આપવામાં આવે છે કે. નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકત કે જે **ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિ. [CIN**: L65922DL2005PLC136029] ("સીક્યોર્ડ ક્રેડિટર") પાસે ગીરવે મુકેલ છે જેનો વાસ્તવિક ਅਹਿਣਾਹੀ ਕਾਹਾ ਰੋਗਾ આવ્યો છે તે 3. 42.94.611/- (3પિર <mark>બેત્તાલીસ લાખ ચોરાણું હજાર છસો અગ્યાર પૂરાં)</mark> ની વસૂલી માટે **22.04.2024** ના રોજ **બપોરે 2.00** થી સાંજના 4.00 વાગ્યા દરમિયાન "જેમ છે" "જ્યાં છે", "જેમ છે જે છે" અને જે પણ જ્યાં છે

ધોરણે વેચવામાં આવશે, જે **પટેલ સાવન ઉર્ફે સાવન સી. પટેલ ઉર્ફે સાવન ચંપકભાઈ પટેલ**, ચંપકભાઈ પી ગિરધરિયા અને સરોજબેન ચંપકભાઈ ગિરધરિયા પાસેથી લોન અકાઉન્ટ નં HHLRAJ00404105 માં બાકી નીકળતી મૂળ રકમ, એરીઅર્સ (જમા થયેલા લેટ ચાર્જિસ સહિત) તે ૪ **27.03.2024** સુધીનાં વ્યાજ સહિત લોને એગ્રીમેન્ટ અને એન્ચ સંબંધિત લોન દસ્તાવેજ(ર્જો)ની શરતો મુજબ **28.03.2024** થી અમલી બન્ને તેમ લાગુ ભાવિ વ્યાજ ઉપરાંત કાનૂની ખર્ચ અને અન્ય યાર્જિસ સहિત સીક્યોર્ડ ક્રેડિટર્સને ચૂકવવાના બાકી નીકળે છે. મૂચિત પ્રોપર્ટીઓના ઓક્શન માટે અનામત કિંમત **રૂ. 21,00,000/- (રૂપિયા એકવીસ લાખ પૂરાં)** છે

અને અર્નેસ્ટ મની ડિપોઝિટ **(''ઇએમડી'') રૂ. 2,10,000/- (રૂપિયા બે લાખ દસ હજાર પૂરાં)** એટલે અનામત મુલ્ય 10 % ના બરાબર રહેશે.

સ્થાવર મિલકત્તનું વર્ણન

રહેણાંક ફ્લેટ નં. 103, 1લા માળે હીર વિલામાં જે કુલ 386.59 ચો. મીટર વિસ્તાર ધરાવતી જમીન પર સ્થિત છે જે પ્લૉટ નં. 28+29, એફ. પી. નં. 13/2, ટી. પી. એસ નં. 26 ઑફ માવડી રેવેન્ય સર્વે નં. 202(પી) ધરાવે છે, જેનો બિલ્ટ અપ એરિયા 52.39 ચો. મીટર છે, જીવરાજ પાર્ક, અંબિક ટાઉનશિપ પાસે (સ્પીડ વેલ પાર્ટી પ્લૉટ પાસે), રાજકોટ - 360004, ગુજરાત. ફ્લેટની સીમાએ આ મુજબ છે :

પૂર્વમાં : માર્જિન અને 7-50 મીટર પઠોળો રસ્તો ઉત્તરમાં : ફ્લેટ નં. 102 દક્ષિણમાં : માર્જિન અને બીજાની મિલકત પશ્ચિમમાં : ફ્લેટ નં.104

કુપા કરીને વેચાણના વિગતસર નિયમો અને શરતો માટે સલામત લેણદાર ની વેબસાઈટ એટલે લિંક vww.indiabullshomeloans.com નો સંદર્ભ લો. અને બિર્ડિંગ માટે www.auctior

અધિકૃત અધિકારી તારીખ : 28.03.2024 ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ સ્થળ : રાજકોટ

પરિશિષ્ટ IV-એ. સ્થાવર મિલકતના વેચાણ માટે સૂચના

સિક્યોરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ 2002ના નિયમ 8(6) અને નિયમ 9(1) મુજબ सेड्योरिटाઇं अंशन એन्ड रिडन्स्ट्रडशन ओइ इाઈनान्शियस એसेट्स એन्ड એन्डोर्समेन्ट ओ સિક્યોરીટી ઈન્ટ્રેસ્ટ એક્ટ 2002 हેઠળ સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ-ઓક્શન વેચાણ સૂચના. આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને કર્જદાર(રો) અને ગૅરંટર(રો)ને સૂચના આપવામાં આવે દ

નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકત કે જે **ઈન્ડિયાબુલ્સ દાઉસિંગ ફાઈનાન્સ લિ. [CIN**: L65922DL2005PLC136029] ("સીક્યોર્ડ ક્રેડિટર") પાસે ગીરવે મુકેલ છે જેનો **વાસ્તવિ**ક કબજો સીક્યોર્ડ ક્રેડિટરના અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે તે રૂં. 66,32,988/- (રૂપિય **છ્યાસઠ લાખ બત્રીસ હજાર નવસો અઠયાસી પૂરાં)** ની વસૂલી માટે **22.04.2024** ના રોજ **બપોરે 2.00** થી સાંજના 4.00 વાગ્યા દરમિયાન "જેમ છે" "જ્યાં છે", "જેમ છે જે છે" અને જે પણ જ્યાં છે દ્યોરણે વેચવામાં આવશે, જે **શર્મિષ્ઠા ડી બારભાયા, એકતા સુમિતભાઈ બારભાયા, બારભાયા કેયુર** દિપકભાઈ, દિપકભાઈ ચમનલાલ બારભાયા અને સુમિત કી બારભાયા પાસેથી લોન અકાઉન્ટ ને HHLRAJ00395167 માં બાકી નીકળતી મૂળ રકમ, એરીઅર્સ (જમા થયેલા લેટ ચાર્જિસ સહિત) તેમ જ **27.03.2024** સુધીનાં વ્યાજ સહિત લોન એગ્રીમેન્ટ અને અન્ય સંબંધિત લોન દસ્તાવેજ(જો)ની શરતો મુજબ **28.03.2024** થી અમલી બન્ને તેમ લાગુ ભાવિ વ્યાજ ઉપરાંત કાનૂની ખર્ચ અને અંન્ય યાર્જિસ સહિત સીક્યોર્ડ ક્રેડિટર્સને ચૂકવવાના બાકી નીકળે છે.

સૂચિત પ્રોપર્ટીઓના ઓક્શન માટે અનામત કિંમત **રૂ. 37,50,000/- (રૂપિયા સાકત્રીસ લાખ પચાસ** હજાર પૂરાં) છે. અને અર્નેસ્ટ મની ડિપોઝિટ ("ઈએમડી") રૂ. 3,75,000/- (રૂપિયા ત્રણ લાખ **પંચોત્તેર હજાર પૂરાં)** એટલે અનામત મૂલ્ય **10** % ના બરાબર રહેશે.

સ્થાવર મિલકત્તનું વર્ણન

કલેટ નં. ટી-1, ત્રીજો માળ, ''પંચરત્ન કૉમ્પ્લેક્સ'', રેવેન્ચૂ સર્વે નં. 337 અને સનદ નં. 70, સીએસ વૉર્ડ નં. 8/1, સીએસ નં. 1997, ટીપીએસ નં. 5, એફપી નં. 194, જે પ્લૉટ નં. 78 સ્ટ્રીટ નં. 2 ઑફ ગીતાનગર પર સ્થિત છે, રાજકોટ - 360002, ગુજરાત. જેની સીમાઓ છે:

: ખુલ્લી જમીન પછી અન્યની મિલકત ઉત્તરમાં દક્ષિણમાં : ખુલ્લી જમીન પછી અન્યની મિલકત ખુલ્લી જમીન પછી અન્યની મિલકત นน์หเ่ : દાદરાંની રૂમ પછી ફલેટ નં. ટી-4 પશ્ચિમમાં

કુપા કરીને વેચાણના વિગતસર નિયમો અને શરતો માટે સલામત લેણદાર ની વેબસાઈટ એટલે લિંક -www.indiabullshomeloans.com નો સંદર્ભ લો. અને બિર્ડિંગ માટે www.auctionfocus.ir નો સંદર્ભ લો.

અધિકૃત અધિકારી તારીખ: 28.03.2024 ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનોન્સ લિમિટેડ સ્થળ : રાજકોટ

પરિશિષ્ટ IV-એ.

સ્થાવર મિલકતના વેચાણ માટે સૂચના

સેક્યોરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ 2002ના નિયમ 8(6) અને નિયમ 9(1) મુજબ भेड्योरिटाઈ डेशन એन्ड रिडन्स्ट्रर्ड्शन ओइ झाઈनान्शियल એसेर्ट्स એन्ड એन्झेर्समेन्ट्रे સેક્યોરીટી ઈન્ટ્રેસ્ટ એક્ટ **2002** हેઠળ સ્થાવર મિલંકતના વેચાણ માટે ઈ-ઓક્શન વેચાણ સૂચના.

આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને કર્જદાર(રો) અને ગૅરંટર(રો)ને સૂચના આપવામાં આવે છે નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકત કે જે **ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિ. [CIN**: L65922DL2005PLC136029] ("સીક્ચોર્ડ ક્રેડિરર") પાસે ગીરવે મુકેલ છે જેનો **વાસ્તવિક કબજો** સીક્યોર્ડ ક્રેડિટરના અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે તે રૂ**. 11,86,799/- (રૂપિયા** અગ્યાર લાખ છ્યાસી હજાર સાતંસો નવ્વાણું પૂરાં) ની વસૂલી માટે 22.04.2024 ના રોજ બપોરે 2.00 **થી સાંજના 4.00 વાગ્યા** દરમિયાન **''જેમ છે["]. ''જયાં છે["], ''જેમ છે જે છે''** અને જે પણ જયાં છે ધોરણે વેચવામાં આવશે**,** જે **સાગર કમલાકર દળવી અને મનિષા ચશવંત ચૌધરી** પાસેથી **લોન** અકાઉન્ટ નં. HHLBRH00465093 માં બાકી નીકળતી મૂળ રકમ, એરીઅર્સ (જમા થયેલા લેટ ચાર્જિસ સહિત) તેમ જ **27.03.2024** સુધીનાં વ્યાજ સહિત લોન એગ્રીમેન્ટ અને અન્ય સંબંધિત લોન દસ્તાવેજ(જો)ની શરતો મુજબ **28.03.2024** થી અમલી બને તેમ લાગૂ ભાવિ વ્યાજ ઉપરાંત કાનૂર્ન મર્ચ અને અન્ય ચાર્જિસ સંદિત સીક્યોર્ડ ક્રેડિટર્સને ચૂકવવાના બાકી નીકળે છે.

સૂચિત પ્રોપર્ટીઓના ઓક્શન માટે અનામત કિંમત **રૂ. 10,15,000/- (રૂપિયા દસ લાખ પંદર હજાર** પૂરાં) છે. અને અર્નેસ્ટ મની ડિપોઝિટ **("ઇએમડી") રૂ. 1,01,500/- (રૂપિયા એક લાખ એક હજાર પાંચસો પૂરાં)** એટલે અનામત મૂલ્ય 10 % ના બરાબર રહેશે

સ્થાવર મિલકત્તનું વર્ણન

ફ્લેટ નં. બી-18, 2જો માળ, બિલ્ડિંગ એ/બી, અક્ષરધામ એપાર્ટમેન્ટ, રાગિણી સિનેમા પાસે, વાલિયા રોક, અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત - 393002.

કુપા કરીને વેચાણના વિગતસર નિચમો અને શરતો માટે સલામત લેણદાર ની વેબસાઈટ એટલે લિંક www.indiabullshomeloans.com નો સંદર્ભ લો. અને બિડિંગ માટે www.auctionfocus.ir

નો સંદર્ભ લો. અધિકૃત અધિકારી તારીખ: 28.03.2024 ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનોન્સ લિમિટેડ સ્થળ : ભરૂચ

SHISH INDUSTRIES LTD

શીશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ : ટીપી નંબર ૪, આરએસ નં. ૧૧ પૈકી, ૧૨–૧૩ બી પૈકી, પ્લોટ સી, પહેલો માળ, ૧૧, ૧૨ સૂર્યપુર મિલ કમ્પાઉન્ડ, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬. ગુજરાત, ભારત. ટેલિફોન : 9925170407, વેબસાઈટ: www.shishindustries.com; ઇ-મેઇલઃ compliance@shishindustries.com

એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગની સુધારવા માટે સૂચના

આથી પ્રિય સભ્યોને તારીખઃ ૧૧ માર્ચ, ૨૦૨૪ ના ઈજીએમ ની સૂચનામાં જજ્ઞાવ્યા મુજબના ખાસ અને સામાન્ય વ્યવસાયો માટે મંજૂરીની માંગ કરતી સૂચનાને સંદર્ભીને આ સૂચના

ઈજીએમ ની ઉક્ત નોટિસની આઇટમ નંબર ૧ પરના સ્પષ્ટીકરણ નિવેદનમાં ફેરફાર અંગે કંપનીના શેરધારકો/લાભકારી માલિકોને જાણ કરવા માટે આ શુદ્ધિકરણ જારી કરવામાં આવી સંબંધિત ફેરફારો ઈજીએમ ની સૂચનાના પાના ક્રમાંક ૧૫ પર કરવામાં આવ્યા છે.

બિંદુ હેઠળ "એન. પોસ્ટ પ્રેફરન્શિયલ ઈસ્યુ કેપિટલની ટકાવારી જે તેમની પાસે હોઈ શકે છે", "કિંજલબેન ઈશ્વરભાઈ કીકાશી" પાસે હોઈ શકે તેવી પોસ્ટ પ્રેફરન્શિયલ ઈશ્યુ મૂડીની ટકાવારીની વિગતો નીચેની વિગતો સાથે બદલવામાં આવશે;

શેરધારકોના	શ્રેશી	પોસ્ટ ઇશ્યૂ – ઇક્વિટી		પોસ્ટ ઇશ્યૂ – વોરંટ	
નામ		શેર્સની સંખ્યા	%	શેર્સની સંખ્યા	%
કિંજલબેન ઈશ્વરભાઈ કીકાશી	જાહેર - બિન-સંસ્થાકીય - વ્યક્તિગત	૨૨૨૧૪	0.0§	૨૨૨૧૪	0.09
Les Chare and a such a case					

ા સુધારજ્ઞાં તારીખઃ ૧૧ માર્ચ, ૨૦૨૪ ના ઈજીએમ ની સૂચના સાથે ચાલુ રાખીને અને સાથે મળીને વાંચવા. આ સુધારજ્ઞાં કંપનીની વેબસાઇટ www.shishindustries.com વેબસાઇટ પર પણ મુકવામાં આવી છે. ઈજીએમ ની સૂચનાની અન્ય તમામ બાબતો જેમ છે તેમ યથાવત રહેશે.

ઈજીએમ ની સૂચનામાં સુધારજ્ઞાંને લગતાં કોઈપજ્ઞ પ્રશ્નો / ફરિયાદો માટે શ્રીમતી સુમન જાટ કંપની સચિવ અને પાલન અધિકારી compliance@shishindustries.com પર ઇ-મેઇલ મોકલી શકે છે અથવા +૯૧ ૯૯૨૫૧૭૦૪૦૭ ફોન કરી શકે છે.

> બોર્ડના આદેશ દ્વારા શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહી/-સતીશકુમાર માણીયા,

સ્થાનઃ સુરત ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તારીખઃ ૩ મી એપ્રિલ ૨૦૨૪ નિયામક ઓળખ નંબરઃ ૦૨૫૨૯૧૯૧

શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ

CIN: L17239GJ1985PLC007829 -**રજિસ્ટર્ડ એક્સિ:** હાર્મની, 4થો માળ, 15/એ, શ્રી વિદ્યાનગર્ કો. <u>ઓ</u>પ. હાઉ. સો. લિ. નાબાર્ડુની સામે, ઉસ્માનપુરા ગાર્ડન પાસે, અમદાવાદ–380014 • **ટેલિફોન નં**.: 079-26565792 ઈ-મેલઃ admin@jagdambapolymers.com • વેબસાઈટઃ www.shrijagdamba.com

जों ટिस (કંપનીના ઇક્વિટી શેરધારકોના ધ્યાન માટે) ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ડીમેટ એકાઉન્ટમાં કંપનીના ઇક્વિટી શેરનું ટ્રાન્સફર

કંપની એક્ટ, ૨૦૧૩ ("અધિનિયમ") ની કલમ ૧૨૪(૬) ની જોગવાઈઓ અનુસાર આ સૂચના આથી કંપનીના શેરધારકોને આપવામાં આવી છે. ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન કંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૬ ('નિયમો') સાથે વાંચો.

કંપનીના નિયમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, વ્યક્તિગત સંદેશાવ્યવહાર એવા શેરધારકોને તેમના નવીનતમ ઉપલબ્ધ સરનામે મોકલવામાં આવે છે જેમણે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ થી છેલ્લા સાત વર્ષ દરમિયાન કંપનીમાં રાખવામાં આવેલા ઇક્વિટી શેરના સંદર્ભમાં ડિવિડન્ડનો દાવો કર્યો નથી અને જેના શેર IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે. કંપનીએ તેની વેબસાઇટ પર આવા શેરધારકોની સંપૂર્ણ વિગતો પશ અપલોડ કરી છે. સંબંધિત શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ EPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટે જવાબદાર શેરની વિગતો ચકાસે. શેરધારકો વધુમાં નોંધ કરી શકે છે કે કંપની દ્વારા તેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી સંબંધિત શેરધારકોની વિગતો કંપની/કોર્પોરેટ એક્શન દ્વારા નવા શેર પ્રમાણપત્ર (ઓ) જારી કરવાના સંદર્ભમાં પર્યાપ્ત સૂચના તરીકે ગજ્ઞવામાં આવશે. નિયમો અનુસાર IEPF ડીમેટ ખાતામાં શેર કરો.

શેરધારકો કંપનીના કંપની/રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)ને પત્ર લખીને તેમના દાવા વગરના ડિવિડન્ડનો દાવો કરી શકે છે. સ્કાયલાઇન ફ્રાઇનાન્શિયલ સર્વિસિસ (P) લિ. દ્વારા રોકાશકાર સેવા વિનંતી ફોર્મ ISR - ૧, ફોર્મ ISR - ૨, ફોર્મ નં. SH ૧૩ (નોમિનેશન ક્ષેમી) અથવા ક્ષેમી ISR-૩ (નોમિનેશન નાપસંદ કરો) પૂરા પાડે છે. તેમાં જશાવેલી સૂચનાઓ અનુસાર યોગ્ય રીતે ભરેલ અને મૂળ રદ કરાયેલા ચેક સહિત સહાયક દસ્તાવેજો સાથે ભૌતિક સિક્યોરિટીઝના કિસ્સામાં ખાતા ધારકનું નામ જજ્ઞાવવાનું રહેશે.

ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિક્યોરિટીઝના કિસ્સામાં ક્લાયન્ટ માસ્ટર લિસ્ટની નકલ સબમિટ કરવાની રહેશે. ડીમેટ ખાતા સામે નોંધાયેલ બેંક ખાતામાં ચુકવજ્ઞી કરવામાં આવશે. મહેરબાની કરીને નોંધ કરો કે ડિવિડન્ડનો દાવો કરવાનો છેલ્લો દિવસ ૨૦ જૂન, ૨૦૨૪ છે. જો આ તારીખ સુધીમાં ડિવિડન્ડનો દાવો કરવામાં ન આવે તો, કંપની દાવા વગરના ડિવિડન્ડ અને સંબંધિત શેરધારકોની તરફેશમાં રાખેલા શેરના ટ્રાન્સફર માટે જરૂરી કાર્યવાહી શરૂ કરશે. IEPF ઓથોરિટી કોઈપજ્ઞ આગળની સૂચના વિના, નિયમો અનુસારો, જેનીચે મુજબ છે.:

• ભૌતિક સ્વરૂપમાં રાખવામાં આવેલા શેર માટે - મૂળ શેર પ્રમાણપત્ર(ઓ) ના બદલે ડુપ્લિકેટ શેર પ્રમાણપત્ર (ઓ) જારી કરવામાં આવશે અને જરૂરી ઐપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી IEPF ઓથોરિટીનો તરફેજામાં ટ્રાન્સફર કરવાના હેતુથી ડીમેટ ફોર્મમાં રૂપોંતરિત કરવામાં આવશે. અસલ શેર પ્રમાણપત્ર (ઓ) જે શેરધારકો (ઓ)ના નામે નોંધાયેલ છે તે રદ થયેલ અને બિન-વાટાઘાટપાત્ર ગજ્ઞાશે.

• ડીમેટ સ્વરૂપે રાખવામાં આવેલા શેરો માટે - કંપની કોર્પોરેટ કાર્યવાહી કરવા અને શેરધારકોના ડીમેટ ખાતામાં પડેલા શેરને ડેબિટ કરવા અને IEPF ઓથોરિટીની તરફેજ્ઞમાં

આવા શેર ટ્રાન્સફર કરવા માટે ડિપોઝિટરીઝને જાણ કરશે. સંબંધિત શેરધારકોને વધુમાં જશાવવામાં આવે છે કે આવા શેરો પર થતા તમામ ભાવિ લાભો પગ્ન IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવશે.

મહેરબાની કરીને નોંધ કરો કે ઉપરોક્ત નિયમો અનુસાર IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરાયેલા ડિવિડન્ડની રકમ અને ઇક્વિટી શેરના સંદર્ભેમાં કંપની સામે કોઈ દાવો કરવામાં

શેરધારકો નોંધ કરી શકે છે કે તેમના દાવા વગરના ડિવિડન્ડ અને શેરને IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવાની સ્થિતિમાં (આવા શેરો પર ઉપાર્જિત થતા તમામ લાભો સહિત, જો કોઈ હોય તો), સંબંધિત શેરધારકો તેના તરફથી દાવો કરવા માટે હકદાર છે. IEPF ઓથોરિટી વેબસાઈટ www.iepf.gov.in પર ઉપલબ્ધ નિયત ઈ-ફોર્મ IEPF-5 માં ઓનલાઈન અરજી સબમિટ કરીને અને તેની એક ભૌતિક નકલ મોકલીને, યોગ્ય રીતે સહી કરેલ (કંપની સાથે નોંધાયેલા નમૂનાની સહી મુજબ)) ઇ-ફોર્મ IEPF-5 માં સૂચિત જરૂરી દસ્તાવેજો સાથે કંપનીને તેની રજિસ્ટર્ડ એફ્સિમાં મોકલો. ઉપરોક્ત બાબતના સંદર્ભમાં કોઈપણ પ્રશ્નો માટે, શેરધારકો કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ, સ્કાયલાઇન ફ્રાઇનાન્સિયલ સર્વિસીસ (P) લિ., નો સંપર્ક કરી શકે છે. ડી-૧૫૩ A ખાતે પહેલો માળ, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા- I, નવી દિલ્હી- 110020, ઇમેઇલ:

admin@skylinerta.com; વેબસાઇટ: www.skylinerta.com. શ્રી જગદંબા પોલિમર્સ લિમિટેડ માટે સહી/-

તારીખ: ૦૩-૦૪-૨૦૨૪ વિકાસ અગ્રવાલ સ્થળ: અમદાવાદ ડિરેક્ટર